



Individuals

1. Work with a partner and between you decide a list of the ten most important objects for feeling happy (eg: a radio, a good book, a TV).
મિત્ર જોડે એક યાદી બનાવો જેમાં દસ વસ્તુઓ લખો જેનાથી ખુશી મળે. (દાખલા તરીકે રેડિઓ, પુસ્તક અને ટી.વી.).
2. Tell your partner the ten items that have made you the happiest so far in your life (*the* toy you played with most, etc.)
તમારા મિત્રને એ દસ વસ્તુઓ જણાવો જે તમને અત્યાર સુધી સૌથી વધુ આનંદ આપી હોય. (દાખલા તરીકે એ રમકડું જેની સાથે તમે સૌથી વધુ વખત રમ્યા હોવ).
3. Look back at the list that you made together in step 1 and discuss whether you want to change any of the items on the list.
તમે ક્રમાંક 1 માં જે યાદી બનાવી તે વિશે તમારા મિત્ર સાથે ચર્ચા કરો. યાદીમાંથી કોઈ વસ્તુ બદલવી છે કે નહીં તે વિશે ચર્ચા કરો.

Group activity

Work in pairs, and complete steps 1-3 above. After revising your list, find a new partner and look at their list. If you have owned any of the items on their list, describe the specific items that you owned, and how useful you found them.

સમૂહ-પ્રવૃત્તિ

જોડીમાં કામ કરો અને ક્રમાંક 1-3 પૂર્ણ કરો. તમારી સૂચિને સુધાર્યા બાદ બીજો મિત્ર શોધો અને તેની યાદી જુઓ. તમારા મિત્રની યાદીમાં કોઈ એવી વસ્તુ હોય જેની માલિકી તમે ધરાવતા હોવ, તો તમે એ વસ્તુ વિશેની માહિતી આપો અને એની ઉપયોગિતા વિશે જણાવો.